

DCM-1601250101062000 Seat No. _____

B. A. (Sem. VI) (W.E.F. 2016) Examination

July - 2022

International Eco.-2

Time	$e: 2\frac{1}{2}$ Hours] [Total Marks:	70
સૂચન	ા : (1) જમણી બાજુના આંક ગુણ દર્શાવે છે. (2) બધા પ્રશ્નો ફરજીયાત છે.	
1	1991 પછી ભારતના વિદેશ વેપારની દિશામાં આવેલા પરિવર્તનો સમજાવો. અથવા	14
1	1991 પછી ભારતના વિદેશ વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનો સમજાવો.	14
2	લેણ-દેણની તુલા એટલે શું? ભારતની લેણ-દેણની તુલામાં ખાધના કારણો ચર્ચો. અથવા	14
2	ભારતની લેણ-દેણની ખાધને દૂર કરવાના ઉપાયો ચર્ચો.	14
3	વિનિમય દર એટલે શું? તે નક્કી કરતા પરિબળો સમજાવો. અથવા	14
3	રૂપિયાની પરિવર્તનીયતા એટલે શું? તેના ઉદ્દેશો સમજાવો.	14
4	વર્તમાન નિકાસનીતિના ઉદ્દેશો જણાવી તેની નિષ્ફળતાઓ ચર્ચો. અથવા	14
4	આંતરરાષ્ટ્રીય વલણોની ભારતના અર્થતંત્ર ઉપરની વર્તમાન અસરો સમજાવો.	14
5	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (1) ભારતની આયાતોના કદમાં આવેલા પરિવર્તનો (2) લેશ-દેશની તુલાની ખાધની અસરો (3) મૂડીખાતા પરની પરિવર્તનીયતાની નિષ્ફળતા (4) અવમૂલ્યન	14

ENGLISH VERSION

Ins	tructions: (1) Figures of right indicates marks.	
	(2) All questions are compulsory.	
1	Explain the changes in the dierection of foreign trade after 1991.	14
	OR	
1	Explain the changes in the composition of foreign trade after 1991.	14
2	What is balance of payment? Discuss the causes of deficit of balance of payment in India.	14
	\mathbf{OR}	
2	Explain the remedies for deficit of balance of payment in India.	14
3	What is exchange rate? Explain the determinant factors of it.	14
	\mathbf{OR}	
3	What is convertibility of rupee? Explain objectives of it.	14
4	Explain the objectives of current export policy and discuss the failures of it.	14
	\mathbf{OR}	
4	Explain the current effects of international trends on Indian economy.	14
5	 Write short note (any two) (1) Changes in import size in India. (2) Effects of deficit of balance of payment. (3) Failure of convertibility of capital account. (4) Devalation. 	14